



[Established : 1930]



એસબીપીપી કો-ઓપરેટીવ બેન્ક લી. (શિડયુલ્ડ બેન્ક)

હેડ ઓફિસ : પારસી સ્ટ્રીટ, કિલ્લા-પારડી-૩૯૬૧૨૫, જિલ્લા-વલસાડ.

ફોન નં.: ૦૨૬૦-૨૩૭૩૨૭૦, મોબાઈલ. નં. 6357937601

પુરવણી પત્રક નંબર ૨

તા.૦૯-૦૮-૨૦૨૬નાં રોજ મળનારી ૯૭મી વાર્ષિક સાધારણ સભામાં રજૂ થનાર

બેન્કનાં પેટાનિયમોમાં સુધારા વધારા કરવા બાબત.

પેટાનિયમ સુધારા - ૨૦૨૬

બેન્કનાં પેટાનિયમમાં નીચે મુજબનાં સૂચિત સુધારા - વધારાઓ કરવા, જેની આગામી મીટીંગમાં બહાલી લેવી.

| પેટાનિયમ નંબર | સુધારા પછી નવો પેટાનિયમ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             | સૂચિત સુધારાનાં કારણો                                                                                                                                                  |
|---------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| નવો ઉમેરો     | <p>બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કુલ સભ્યો પૈકી :</p> <p>(a) ઓછામાં ઓછા એકાવન ટકા (51%) સભ્યો એવા હોવા જોઈએ કે જેઓ નીચે દર્શાવેલ એક અથવા વધુ વિષયોમાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ ધરાવતા હોય:</p> <p>(i) હિસાબીશાસ્ત્ર (Accountancy)</p> <p>(ii) કૃષિ અને ગ્રામિણ અર્થતંત્ર (Agriculture and Rural Economy)</p> <p>(iii) બેન્કિંગ (Banking)</p> <p>(iv) સહકાર (Co-operation)</p> <p>(v) અર્થશાસ્ત્ર (Economics)</p> <p>(vi) નાણાશાસ્ત્ર (Finance)</p> <p>(vii) કાયદો (Law)</p> <p>(viii) લઘુ ઉદ્યોગ (Small Scale Industry)</p> <p>(ix) અન્ય કોઈ એવો વિષય કે જેમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ બેંક માટે ઉપયોગી હોવાનું ભારતીય રિઝર્વ બેંકના મતે ગણાય.</p> <p>વધુમાં, ઉપરોક્ત લાયકાત ધરાવતા ડિરેક્ટરો પૈકી ઓછામાં ઓછા બે ડિરેક્ટરો એવા હોવા જોઈએ કે જેઓ કૃષિ અને ગ્રામિણ અર્થતંત્ર, સહકાર અથવા લઘુ ઉદ્યોગ ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ ધરાવતા હોય. અને</p> <p>(b) નીચે મુજબ ન હોવો જોઈએ –</p> <p>(1) નીચે દર્શાવેલ પૈકીની કોઈ સંસ્થા સાથે નોકરીયાત, મેનેજર અથવા મેનેજિંગ એજન્ટ તરીકે નોંધપાત્ર હિત (substantial interest) ધરાવતો અથવા સંકળાયેલો ન હોવો જોઈએ–</p> <p>(i) કંપની અધિનિયમ, 1956 ની કલમ 25 હેઠળ નોંધાયેલ કંપની સિવાયની કોઈપણ કંપની; અથવા</p> <p>(ii) કોઈપણ એવી પેઢી (Firm), જે કોઈ વેપાર, વાણિજ્ય અથવા ઉદ્યોગ ચલાવતી હોય અને જે કોઈ પણ કિસ્સામાં લઘુ ઉદ્યોગ એકમ (Small-scale Industrial Concern) ન હોય; અથવા</p> <p>(2) કોઈપણ એવા વેપારી, વાણિજ્યિક અથવા ઔદ્યોગિક એકમનો માલિક (Proprietor) ન હોવો જોઈએ, જે લઘુ ઉદ્યોગ એકમ (Small-scale Industrial Concern) ન હોય.</p> | <p>બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACCS) ની કલમ 10A(2) ની જોગવાઈઓ તા. 1 ઓગસ્ટ, 2025 થી અર્બન કો-ઓપરેટિવ બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.</p> |
| નવો ઉમેરો     | નીચે જણાવેલ વ્યક્તિઓ ડિરેક્ટર તરીકે પાત્ર ગણાશે નહીં:                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               | બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,                                                                                                                                              |

|           |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          |                                                                                                                                                                                                        |
|-----------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|           | <p>(1) જે કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં નોંધપાત્ર હિત (Substantial Interest) ધરાવતી હોય અથવા કર્મચારી, મેનેજર અથવા મેનેજિંગ એજન્ટ તરીકે સંકળાયેલી હોય, જો કે આવી કંપની:</p> <p>(i) કંપનીઝ એક્ટ, 1956 ની કલમ 25 હેઠળ નોંધાયેલ કંપની ન હોય; અથવા</p> <p>(ii) એવી કોઈ પેઢી (Firm) સાથે સંકળાયેલી હોય કે જે વેપાર, વાણિજ્ય અથવા ઉદ્યોગ ચલાવતી હોય અને જે લઘુ ઉદ્યોગ (Small Scale Industrial Concern) ન હોય.</p> <p>(2) કોઈ એવી વેપારી, વાણિજ્યિક અથવા ઔદ્યોગિક સંસ્થાના માલિક (Proprietor) હોય કે જે લઘુ ઉદ્યોગ તરીકે વર્ગીકૃત ન થતી હોય.</p>                                                                                                                                                                     | <p>1949 (AACS) ની કલમ 10A(2) ની જોગવાઈઓ તા. 1 ઓગસ્ટ, 2025 થી અર્બન કો-ઓપરેટિવ બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.</p>                                                            |
| નવો ઉમેરો | <p>જો કોઈપણ સમયે સંબંધિત પેટા નિયમમાં નિર્ધારિત કરેલ જોગવાઈઓનું પાલન થતું ન હોય, તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બોર્ડનું પુનર્ગઠન (Re-constitution) કરવું પડશે જેથી ઉપરોક્ત જોગવાઈઓનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત થઈ શકે.</p> <p>જો સંબંધિત પેટા નિયમની પેટા કલમ મુજબ બોર્ડનું પુનર્ગઠન (Re-constitution) કરવા માટે કોઈ ડિરેક્ટર અથવા ડિરેક્ટરોને નિવૃત્ત કરવાનું જરૂરી બને, તો બોર્ડ ચિઠ્ઠી ઉપાડવાની (Draw of Lots) નિર્ધારિત પદ્ધતિ દ્વારા નક્કી કરશે કે કયા ડિરેક્ટર અથવા ડિરેક્ટરો પદ પરથી નિવૃત્ત થશે. બોર્ડનો આ નિર્ણય તમામ ડિરેક્ટરો માટે બંધનકર્તા રહેશે.</p>                                                                                                                                                | <p>બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 10A(2) ની જોગવાઈઓ તા. 1 ઓગસ્ટ, 2025 થી અર્બન કો-ઓપરેટિવ બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.</p>                                  |
| નવો ઉમેરો | <p>RBI દ્વારા જારી કરવામાં આવેલ બ્રાન્ચ ઓથોરાઈઝેશનમાં નોર્મ્સનું પાલન થતું હશે અને પૂરતા પ્રમાણમાં હેડરૂમ કેપીટલ હશે તો, એક ફાઈનાન્સીયલ વર્ષ દરમિયાન બેન્ક તેના સ્ટેટ ચોફ રજીસ્ટ્રેશનના પોતાની પસંદગીના વધુમાં વધુ ત્રણ ડિસ્ટ્રિક્ટ કાર્યક્ષેત્રમાં ઉમેરી શકશે જેના માટે RBI ની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં.</p> <p>પરંતુ જો ઉપર દર્શાવ્યા પ્રમાણે ત્રણ ડિસ્ટ્રિક્ટથી વધુ ડિસ્ટ્રિક્ટને કાર્યક્ષેત્રમાં ઉમેરવાના હશે તો RBI ની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.</p>                                                                                                                                                                                                                                         | <p>RBIના તા.૨૬-૧૧-૨૦૨૫ ના બ્રાન્ચ ઓથોરાઈઝેશન ના પરિપત્રના પેરા નંબર-૧૪નું પાલન કરવા.</p>                                                                                                               |
| નવો ઉમેરો | <p>સંચાલક મંડળના સભ્ય સતત દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતા, સંચાલક મંડળના સભ્ય તરીકે રહી શકશે નહીં. આ રીતે ફારેગ થયેલા સંચાલક મંડળના સભ્ય RBI દ્વારા વખતો વખત જે Cooling off period ની જોગવાઈ જાહેર કરવામાં આવે તેટલા સમયનો Cooling off period પછીજ સંચાલક મંડળના સભ્ય તરીકે ચુંટાવાને પાત્ર થશે. આ Cooling off period દરમિયાન તે બેન્કના માત્ર સભાસદ તરીકે ચાલુ રહી શકશે. આ સિવાય અન્ય કોઈ રીતે (જેમકે સલાહકાર/ કમીટી મેમ્બર/ BOM ના સભ્ય વગેરે) બેન્ક સાથે સંકળાઈ શકશે નહીં. ફારેગ થયેલ સંચાલક મંડળના કોઈપણ સભ્ય જો RBI એ જણાવેલ Cooling off period કરતાં ઓછા સમયગાળાનો Cooling off period લીધેલ હશે તો તે Cooling off period ને સંચાલક મંડળના સભ્ય તરીકેની સતત ટર્મમાં બ્રેક તરીકે ગણવામાં નહીં આવે.</p> | <p>બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1948(AACS) ની કલમ 10A(2A)(i) તેમજ RBI ના તા.૨૫-૦૫-૨૦૨૬ના સરકયુલર No.DOR.GOV. REC.NO.82/18.10.0 14/2026-27 (Urban Co-Operative Banks-Governance) ની જોગવાઈનું પાલન કરવા</p> |
| નવો ઉમેરો | <p>જરૂરિયાત પ્રમાણે બેન્કની વાર્ષિક સાધારણ સભા Online (Virtual) mode માં કરી શકાશે. RBI તથા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ દ્વારા વખતોવખત કરવામાં આવતાં સુધારાઓ / સરકયુલર / સૂચનોનું અમલ બેન્કે કરવાનું રહેશે.</p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         | <p>વહીવટી સુગમતા ખાતર</p>                                                                                                                                                                              |